#### **MAITRI ENTERPRISES LIMITED**

(Formerly Known us PARTH ALLUMINIUM LIMITED)



Date: April03, 2024

**To, BSE LIMITED**P.J. Towers,
Dalal Street,
Mumbai-400001

Sub.: Newspaper Advertisement for completion of dispatch of Postal Ballot Notice BSE Scrip Code: 513430

Dear Sir/Madam,

In Compliance with Regulation 30 and 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find attached herewith copies of newspaper advertisement regarding completion of dispatch of Postal Ballot Notice dated April01, 2024 published on April03, 2024 in the Free Press Gujarat in English Newspaper and Lokmitra in Gujarati Newspaper.

This is for your intimation and record.

Thanking you,

Yours faithfully, FOR,MAITRI ENTERPRISES LIMITED

JAIKISHAN R. AMBWANI MANAGING DIRECTOR DIN: 03592680

aside for his brother; this is being seen as an acknowledgement of his party's lacklustre performance in the February elections in which the real winners in the popular perception were Imran Khan and his supporters, many of whom contested and won as indepen-dent forming the single largest group in the new National Assembly. They outnumber the two other national parties — the Pakis-tan Mus-lim League-Nawaz of the Sharif brothers and the Pakistan Peoples Party of the Bhuttos.

The real takeaway from this elec-tion was how well Imran Khan and his supporters performed in spite of the evident and strong opposition of the military establishment.

The anti-military/anti-establishment spa-ce in Pakistan is now occupied by Imran Khan. His electoral performance and him biding his time in jail add unpredictable, even combustible, elements to Pakistan's perennial cocktail of deeply problematic issues.

Over the past three weeks, a new architecture has emerged in Pakistan — a new government but one that has many familiar faces. Shehbaz Sharif is back in spite of some expecting Nawaz Sharif to be the prime minister for a fourth time. The latter stepped aside for his brother; this is being seen as an acknowledgement of his party's lacklustre performance in the February elections in which the real winners in the popular perception were Imran Khan and his supporters, many of whom contested and won as indepen-dent forming the single largest group in the new National Assembly. They outnumber the two other national parties — the Pakis-tan Mus-lim League-Nawaz of the Sharif brothers and the Pakistan Peoples Party of the Bhuttos. The real takeaway from this elec-tion was how well Imran Khan and his supporters performed in spite of the evident and strong opposition of the military establishment. The antimilitary/anti-establishment spa-ce in Pakistan is now occupied by Imran Khan. His electoral performance and him biding his time in jail add unpredictable, even combustible, elements to Pakistan's perennial cocktail of deeply problematic issues. Alongside the new government, Pakistan also has a new president in the familiar face of Asif Ali Zardari. For the first time, Pakistan will have a president elected to serve for a second term. His first tenure as president from 2008 to 2013 was in the aftermath of the assassination of Benazir Bhutto. That made Zardari a Bhutto legatee in a true sense as the father to Benazir's children. His political career merits recalling. Through much of the 1990s and the early years of this century, Zardari was in jail as an undertrial facing numerous corruption charges. But this was also a means of pressurising Benazir Bhutto. He was ultimately never convicted despite spending some 11 years in jail — a record of sorts in Pakistan, perhaps even the whole of South Asia. To some, Zardari is a big-time crook and, for others, he is an astute politician; but the significant fact is that he is the president again. Zardari's political profile and the fact that he and his children head the PPP mean that his role will be much more than that of a ceremonial head of State.

#### How deep-sea mining can power India's green transition

the space race and the nuclear arms race have long captured our imagination. However, there's a new contender on the horizon – the deep-sea depths of the ocean, driven by the promise of untold resources lying beneath the into the deep sea domain. waves. According to scientists, the ocean floor is a treasure beneath the waves? Polytrove waiting to be tapped, with estimates valuing its rocks laden with coveted rare resources between a staggering eight to 16 trillion dollars. India, too, has joined this burgeoning race, aiming to mine the deep sea for its

But how does one embark on such a venture? The first step is securing permission, a license to explore the seabed, granted by the International Seabed Authority (ISA), a energy infrastructure. United Nations body responsible for regulating deep-sea mining. India has already obtained two such Environmentalists and licenses back in 2016, but it concerned nations advocate now seeks to expand its reach with two additional licenses. One of these licenses is of deep-sea ecosystems. The designated for exploring the Indian Ocean's Carlsberg Ridge, while the other aims to investigate a seamount, both potentially rich in valuable conducted. Yet, amidst these minerals. While India awaits approval, its legal team engages with the ISA. demonstrating compliance with regulations.

abundant resources.

Yet, obtaining a license is merely the beginning. The next hurdle is the actual seized the opportunity, descent to the seabed, a securing multiple exploration perilous endeavour fraught with challenges unique to the deep sea environment. Unlike Indian Ocean region, aims to space, where the vacuum assert its presence through reigns, the deep sea exerts immense pressure, capable of crushing both vessels and their unfold, India finds itself at a occupants. Preparation and crossroads, balancing the technological innovation are allure of economic prosperity paramount. In 2021, India with unveiled its Deep Ocean stewardship.

In the annals of human Mission, allocating a exploration, the narratives of substantial budget of \$480 million towards this ambitious project. Central to this mission is the development of exploration vehicles like Matsya 6000, a self-propelled race. Instead of reaching for marine vessel designed to the stars or harnessing the withstand the crushing depths power of atoms, nations are of 6,000 metres. Scheduled for now setting their sights on the launch in 2026 under the moniker "Samudrayaan," this vessel heralds India's foray

> But what awaits explorers metallic nodules, potato-sized earth metals such as manganese, cobalt, nickel and copper hold the promise of vast riches. India anticipates a potential haul of 380 million tonnes of these nodules, valued at a staggering 110 billion dollars. These minerals are crucial for various industries, from battery manufacturing to renewable

However, the pursuit of deep-sea mining is not without

for caution, citing the fragile and poorly understood nature risks of irreversible damage loom large, prompting calls for a temporary ban on mining until thorough studies are geopolitical concerns, dynamics come into play. With the United States abstaining from deep-sea mining due to its non-ratification of the UN Convention on the Law of the Sea, China and Russia have licenses. India, cognizant of the strategic importance of the deep-sea mining initiatives. As international discussions environmental

## Rocky road ahead Amid Cold War 2.0, Putin's fifth term Over the past three weeks, a new architecture has emerged in Pakistan—a new government but one that has many familiar faces. Shehbaz Sharif is back in spite of some expecting Nawaz Sharif to be the prime minister for a fourth time. The latter stepped aside for his brother; this is being seen as an acknowledgement will consolidate Russia's position



In the recently held that. The Russians have an presidential elections in the Russian Federation, two things were foregone conclusions. President Putin will win his fifth election with a wide margin, and the West will junk these elections as undemocratic, corrupt, and stolen. No doubt, dissent and divergence in democracy are natural and a must. This was evident in the large-scale voter turnout both in Russia and among Russians abroad.

Occasional protests were witnessed that were germane due to the death of long-time dissident leader Navalny in an Arctic jail, the arrest of some opposition leaders, and the disqualification of others. But the Russians are at war, which might be the key to understanding.

Some might oppose it, as is natural, and would want a change in the leadership. But when the question of Russian nationalism and patriotism as the war by the West confronts them, they want a against Russia as the Grey leader who can withstand the external pressures and win it

Russian history attests to

But the Russian 'war economy', which has performed as well, if not better, than their Western partners, growing at over 3 per cent, has gone in Putin's favour. During his 24 years, the GDP seems to have grown by over 11 times to \$2.2 trillion, and its debt-to-GDP ratio went down from 92 per cent to 23 per cent of GDP. Consequently, with a declining population, uncanny ability to handle pain per capita income also went and adversity. This also up by 10 times, and inflation explains Putin's wide margins is said to be down to 3.5 per of victory, apart from the fact cent from a high of 36.6 per that this has been a trend all cent in 1999. along with weak, not so popular, and credible opposition candidates or

All these do have an impact on people's political preferences. Hence, Putin's approval ratings have been hovering above 70 per cent.

Even the ruble has

definitely impacted the

Russian economy and policy.

stabilised and is emerging as a currency backed by huge gold reserves of \$600 billion, compared to the US dollar, which abdicated the gold standard some fifty years ago. In response to weaponisation of financial instruments, the cutting off of Russia from Western financial architecture, and the confiscation of its over \$360 billion reserves, Moscow weaponised: food, fuel, and fertilisers. These 4F have played havoc with the global economy and society, especially the Global South, let alone the contending parties. It is leading to incremental dedollarisation as more and more countries resort to

bilateral or plurilateral

Western sanctions may have exchange mechanisms.

Russia, which is chairing the BRICS-plus this year, will hope to push for alternate financial architecture and clearing mechanisms in concert with the already ongoing 'yuanaisation' of the currency landscape by China.

Putin, in his victory speech, took a dig at the US, the greatest democracy, which is going through a major domestic challenge. He called his country's democracy arguably a better model. In any case, while democracy with robust institutions remains the best form of governance, many countries and people have begun to question whether the Westminster style is the best fit for them. Being faced with Western isolationism, Putin began to focus more on the East and Global South, especially in Asia and Africa and even Latin America, and has been able to extract significant support and appreciation for his policies despite direct confrontation with the West using its resource and energy tools. BRICS-plus, the SCO, the Eurasian landscape, and

instruments for regaining was staring at you in invasions influence.

This was evident in the congratulatory messages Putin continued to receive from various leaders as criticism in the West grew louder.

India and Russia have been special, privileged, strategic, and trusted partners since Putin took over the reins of Russia nearly a quarter century ago. The leadership of both countries is heavily invested in it. During the Soviet/Russian era, Moscow stood with India and protected her vital interests in the international forum, especially during the Cold War era, while helping build up its industrial base. President Putin has publicly many times praised PM Modi and his leadership for India's rise. New Delhi, despite not endorsing the invasion of Ukraine and urging dialogue, diplomacy, and respect for the UN Charter, did appreciate the Russian security concerns and did not condemn them, which the western countries pressured her to. The reason was that it could not be a pick-andchoose approach while the focused connectivity have barely two-decade-old history salient by the day.

become the preferred of unilateralism by the West of Iraq, Libya, Afghanistan, and elsewhere, leaving a trail of destruction. Two wrongs do not make one right, but one can ignore the wrong and hypocrisy at one's peril.

Among many felicitation messages, Prime Minister Narendra Modi tweeted warmly, "Warm congratulations to H.E. Mr. Vladimir Putin on his reelection as the President of the Russian Federation. We look forward to working together to further strengthen the timetested Special and Privileged Strategic Partnership between India and Russia in the years to come." That says it all for a bilateral relationship that is poised for further momentum

despite the global downturn. Whether Putin's victory will lead to the resolution of the Russia-Ukraine war or the escalation and expansion of the conflict between Russia and NATO, with nuclear threats hanging by the thread, remains to be seen. But very likely, Moscow will consolidate its position in the global discourse even as factors for Cold War 2.0 become more

#### Record boom in coffee market on the back of short supply

In the country and overseas markets, trends have been seen to be reversed in the coffee sector. The prices of coffee beans were seen rising rapidly. According to market sources, prices were recently seen trading at highs around 15-year highs. A decade of pessimism has been replaced by optimism among coffee farmers. However, due to erratic rains, coffee production per hectare has decreased, whereas farmers in Chikmagalur and Kojadu in South India's Hassan region have seen relief as prices have reached record highs. The prices of Robusta coffee beans increased to around Rs 6,600 to Rs 6,800 per 50 kg while the prices of Arabica coffee beans e seen trading at Rs 7,750 to Rs 7,850 recently. According to world market informants, coffee production has been hit due to adverse weather conditions in the South American country of Brazil. Farmers have also recently been seen replanting coffee plantations in many of Brazil's coffee-growing regions. Brazil has been at the fore as the largest exporter of coffee in the world market. In such an environment, the price of coffee in the world market was seen to go up. The possibility of domestic coffee production to be around 3 lakh 50 to 55 thousand tons is being shown by the government-owned coffee-board. The highest production of coffee in India is n Karnataka and the share of Karnataka in the total production of coffee in the country has been around 70 to 71 percent. After Karnataka comes Kerala's rank in this regard. Kerala ranks second in

the total production of coffee

and the percentage of

production in Kerala is about 21 percent of the total production. Coming third after Kerala, Tamil Nadu has such a percentage of

#### **MAITRI ENTERPRISES LIMITED**

CIN: L45208GJ1991PLC016853 Regd. Office: "Gayatri House", Ashok Vihar, Near Maitri Avenue Society, Opp. Govt. Eng. College, Motera, Sabarmati, Ahmedabad-380005 PHONE: 079-27506840, EMAIL: compliance@maitrienterprises.com Website: www.maitrienterprises.com

#### **NOTICE OF POSTAL BALLOT**

Members are hereby informed that dispatch of the Postal Ballot Notice dated Apri 01, 2024 (along with the Explanatory Statement) to the members of the Company in respect of the Resolutions as set out in the Notice of Postal Ballot has been completed on Tuesday, April 02, 2024 for the following resolution:

Item No. 1: To Consider and Approve the Appointment of M/s. Dinesh R. Thakkar & Co., Chartered Accountants, Ahmedabad (FRN: 102612W) as the Statutory Auditors of the Company to fill the Casual Vacancy caused by Resignation of M/s Shailesh Gandhi & Associates, Chartered Accountants, Ahmedabad (FRN

Item No. 2: To Consider and Approve the borrowing limits under section 180(1)(c) of the Companies Act, 2013.

Item No. 3: To Consider and Approve Inter-Corporate Loans, Investments, Guarantee or Security and Acquisition under Section 186 of the Companies Act, 2013. Item No. 4: To Consider and seek approval under Section 180(1)(a) of the Companies Act, 2013 inter alia for Creation of Mortgage or Charge on the Assets,

Pursuant to the provisions of Section 108 and other applicable provisions, if any, of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Admin istration) Rules, 2014, as amended from time to time, and Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 and Circulars issued by MCA & SEBI, the Company is offering the facility of e-voting to its Members The facility of casting votes by Member using remote e-voting system as well as e voting during the Postal Ballot will be provided by Central Depository Services (India Limited (CDSL) and the business may be transacted through such voting.

The E-voting period commences on Saturday, April 06, 2024 at 09.00 a.m. and ends on Sunday, May 05, 2024 at 5.00 p.m. IST. During this period, Members may cast their vote electronically. The e-voting module shall be disabled by CDSI thereafter. A vote once cast on the resolution, would not be allowed to be changed subsequently.

The voting rights of Members shall be in proportion to the Equity Shares held by them in the paid-up Equity Share Capital of the Company as on Friday, March 29 2024 (Cut-Off date). Members are eligible to cast their vote only if they are holding shares as on the cut-off date. A person who is not a Member as on the cut-off date should treat this Notice for information purpose only.

As per the SEBI circular dated December 09, 2020 read with SEBI Master Circular dated July 11, 2023 on e-voting facility provided by Listed Companies, e-voting process has been enabled to all the individual demat account holders, by way o single login credential, through their demat accounts / websites of Depositories, Depository Participants (DPs) in order to increase the efficiency of the voting process. Members are advised to update their mobile number and email address with their respective DPs in order to access e-voting facility. Detailed instructions for login methods of remote e-voting are provided in the Notice of Postal Ballot. For details relating to remote e-voting, please refer to the Notice of the Postal Ballot In case of any queries relating to voting by electronic means, please refer to the FAO and e-voting manual available, at www.evotingindia.com or contact at 022 230585542/43, in case of any grievance relating to e-voting please contact Mi Rakesh Dalvi, Manager, Central Depository Services (India) Limited, A Wing, 25th Floor, Marathon Futurex, Mafatlal Mill Compounds, N M Joshi Marg, Lower Parel (East), Mumbai - 400013 or send an email to helpdesk evoting@cdslindia.com or call 022-23058542/43.

For, Maitri Enterprises Limited

Jaikishan Rameshlal Ambwani Managing Director DIN:(03592680)

#### Will political churn hurt Vietnam's economy and investments?

The unprecedented

parties. The there-is-no-

alternative (TINA) factor also

the West and continuous

tirades against their strongest

opponent add to his appeal.

Ironically, the West is equally

responsible for Putin's victory.

Well, Russia says it has it's

own democratic governance

pride and Putin redeeming

their pride back after the

greatest humiliation in the

wake of the disintegration of

the Soviet Union, the ongoing

Russia-Ukraine war is being

perceived, at a popular level,

Zone warfare and one-sided

narratives predominate their

respective global spaces.

Apart from the Russian

Regime change agendas of

operates in such a scenario.



Vietnam, the vibrant Vietnam's political landscape. Southeast Asian nation known for its resilience and economic growth, has found itself embroiled in a relentless battle against corruption. The crackdown, corruption within the country's political and administrative spheres.

resignation of President Vo as a testament to the Van Thuong, marking him as campaign's intensity. Vietnam's shortest-serving president. the ruling Communist Party, underscores the severity of corruption allegations plaguing even the highest echelons of power.

The Communist Party's statement regarding Thuong's resignation cited his violations and flaws as perception and the party's reputation. While specific influence. infractions were not detailed, the implication was clear: Thuong's association with corruption necessitated his removal from office.

Thuong's resignation adds to a troubling trend within regional-level party worker Vietnamese leadership. His resurfaced. This revelation predecessor, Nguyen Xuan casts doubt on the motives Phuc, was similarly forced to resign due to corruption investigations, prompting allegations just over a year speculation about political ago. This swift succession of agendas driving the antipresidential resignations corruption campaign. underscores the systemic

The "Blazing Furnace" anti-corruption campaign, spearheaded by the Communist Party under the leadership of General Secretary Nguyen Phu Trong, termed the "Blazing has led to the removal and Furnace," has brought to light imprisonment of numerous the pervasive nature of officials across all levels of government. The sheer magnitude of individuals affected, including high-The most recent headline- ranking figures such as grabbing development former health minister revolves around the Nguyen Thi Kim Tien, serves

While the crackdown on Thuong's corruption is commendable departure, orchestrated by on the surface, its unprecedented scale raises pertinent questions about the underlying causes of widespread corruption in Vietnam. The country's political system, dominated by the Communist Party, concentrates power in the hands of a select few, with detrimental to public the General Secretary wielding the greatest

> In the case of President Thuong, his close association with General Secretary Trong positioned him as the chosen successor until an old bribery charge from his tenure as a behind certain corruption

However, beyond the nature of corruption within political manoeuvring lies a

more pressing concern: the detrimental impact of the crackdown on Vietnam's stability and economic prospects. Public outrage over pervasive corruption has led to governmental paralysis, as officials fear implications in potential scandals. This climate of uncertainty has deterred investors and stalled projects, contributing to a slowdown in economic growth. Vietnam's remarkable

economic trajectory in recent decades has been marred by the persistent shadow of corruption. While the nation has capitalized on its strategic positioning and favourable economic policies to attract investment, the unchecked growth has fuelled systemic corruption. As Vietnam navigates the delicate balance between economic expansion and corruption eradication, it faces the daunting task of preserving its hard-won successes without sacrificing integrity.

Vietnam's internal crackdown on corruption past and forge a path that prioritizes transparency, accountability and the welfare

of its people.

serves as a sobering reminder of the challenges inherent in achieving sustainable development. While the pursuit of economic prosperity is paramount, it must not come at the expense of ethical governance and social justice. As Vietnam charts its course forward, it must heed the lessons of its

Place: Ahmedabad

SYMBOLIC POSSESSION NOTICE Branch Office: ICICI Bank Lto., Office Number 201-B, 21d 1 1001, 1002 1001 Plot No-B3, WIFI IT Park, Wagle Industrial Estate, Thane, Maharashtra- 400604 Branch Office: ICICI Bank Ltd., Office Number 201-B, 2nd Floor, Road No 1

The undersigned being the Authorized Officer of ICICI Bank Limited under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of the powers conferred under section 13 (12) R/w Rule 3 of the Security Interest (Enforcement) rules 2002, issued demand notices upon the borrowers mentioned below, (on underlying pool assigned to ICICI Bank by Dewan Housing Finance Ltd.) in relation to the enforcement of security in respect of a housing loan facility granted pursuant to a loan agreement entered into between DHFL and the borrower, to repay the amount mentioned in the notice within 60 days from the date of receipt of the said notice.

As the borrower failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken Symbolic possession of the property described herein below in exercise o powers conferred on him/ her under Section 13(4) of the said Act read with Rule 8 of the said rules on the below-mentioned dates. The borrower in particular and the public in general is hereby cautioned not to deal

with the property and any dealings with the property will be subject to the charge of ICICI Bank I							
	Sr. No.	Number (Lean Account	Description of Property/ Date of Symbolic Possession	Date of Demand Notice/ Amount in Demand Notice (Rs.)	Name of Branch		
		Rahish Banjara & Sabarunisha Rahish Banjara- (Old DHFL Lan No. 01800008947 & New ICICI Lan No. QZBRD00005035577)	Flat No-102, 1st Floor, Tower-e, Fatima Heights, Near Aatif Nagar, Tandalja Road, R.s No- 253-254, C.t S No-162-163, T.P S No. 26, F.P No- 16, Tandalja, Vadodara 391100/ March 28, 2024	December 01, 2023/ Rs. 13,62,752/-	Vadodra		

The above-mentioned borrowers(s)/ guarantors(s) are hereby given a 30 day notice to repay the amount, else the mortgaged properties will be sold on the expiry of 30 days from the date of publication of this Notice, as per the provisions under the Rules 8 and 9 of Security Interest (Enforcement) Rules 2002. Date: April 03, 2024

**Authorized Officer ICICI Bank Limited** 

### વિદેશમાં નોકરી આપવાના બહાને ભારતીય યુવાઓ સાથે છેતરપિંડી

ફ્રોડ ગેંગ ઝડપાયા બાદ મોટા ખુલાસા તપાસ કરી ત્યારે મોટા અને સામે આવી રહ્યા છે. એજન્સીઓની તપાસમાં સામે આવ્યું છે કે, ભારતમાંથી શિક્ષિત અને કોમ્પ્યુટર આવી હતી અને વિદેશ મંત્રાલય નિષ્ણાત યુવાનોને નોકરી સાથેની ઉચ્ચ સ્તરીય બેઠકમાં અપાવવાના બહાને કંબોડિયા સાયબર ફ્રોડ ગેંગ સાથે વ્યવહાર બોલાવવામાં આવે છે અને ત્યાં તેમને કરવા પર ચર્ચા થઈ હતી. સાયબર ગુલામીનો શિકાર બનાવવામાં આવે છે. કેન્દ્રીય ગૃહ રાઉરકેલા પોલીસે 'ફેક સ્ટોક ટ્રેડિંગ

ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા. તે પછી સ્ૐછને માહિતી આપવામાં

તાજેતરમાં જ ઓડિશાની

BY NXTBLOC

#### સિઆમ સિમેન્ટ બિગબ્લોક કન્સ્ટ્રક્શને ખેડામાં તેના ગ્રીનફકલ્ડ યુનિટમાં એએસી બ્લોક્સ તથા એએલસી પેનલ્સના ઉત્પાદનનો પ્રારંભ કર્યો **EMARTBUILD** WALL

બિગબ્લોક કન્સ્ટક્શન ટેક્નોલોજીસ ૬૫ કરોડનું છે. આ યુનિટ વર્ષે પ્રાઇવેટ લિમિટેડ (બિગબ્લોક ૫૦,૦૦૦-૬૦,૦૦૦ યુનિટ્સ કન્સ્ટ્રક્શન લિમિટેડની પેટા કંપની) ઇન્ટરનેશનલ ઈન્ડિયા પ્રાઇવેટ પ્લાન્ટ વર્ષે રૂ. ૧૦૦ કરોડ જેટલી લિમિટેડ ને ગુજરાત સ્થિત બિગબ્લોક આવક ઊભી કરે તેવી સંભાવના છે. કન્સ્ટ્રક્શન લિમિટેડ વચ્ચેનું સંયુક્ત સાહસ છે તેણે અમદાવાદ (ગુજરાત) નજીક ખેડા જિલ્લામાં તેના ગ્રીનફિલ્ડ પ્રોત્સાહન આપવા તેમજ કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટમાં વર્ષે ૨.૫ લાખ ક્યુબિક ઉદ્યોગમાં સહયોગ સાધવા તેમજ મીટરની ક્ષમતા સાથે ઉત્પાદન શરૂ કરી દીધું છે. આ સંયુક્ત સાહસ કંપની પ્લાન્ટ ખેતા એએસી બ્લોક્સ અને એએલસી પેનલ્સનું ઉત્પાદન કરશે અને બ્રાન્ડ નેમ 'ZMARTBUILD મંજૂરી પછી બીજા તબક્કામાં વર્ષે પ WALL by Nxtbloc' હેઠળ તેની લાખ સીબીએમ સુધી વિસ્તારી શકાય પ્રોડક્ટ્સનું માર્કેટિંગ કરશે. ખેડા છે. (૧૮-૨)

અમદાવાદ, સિઆમ સિમેન્ટ પ્રોજેક્ટમાં કુલ રોકાણ લગભગ રૂ. કાર્બન ક્રેડિટ્સનું ઉત્પાદન કરવાની થાઈલેન્ડની એસસીજી ક્ષમતા ધરાવે છે. સંપૂર્ણ ક્ષમતા સાથે સંયુક્ત સાહસ ટેક્નો-કોમર્શિયલ નોલેજ વહેંચવા, પારસ્પરિક વૃદ્ધિને ભારતીય બજારોમાં નવા જમાનાના બિલ્ડિંગ મટિરિયલ્સ રજૂ કરવાનો ઉદ્દેશ ધરાવે છે. ખેડા કપડવંજ પ્રોજેક્ટ બંને સંયુક્ત સાહસ પક્ષકારોની

#### Grew એનર્જીએ સીઓઓ તરીકે શ્રી હરદીપ સિંઘની નિમણુકની જાહેરાત કરી



અમદાવાદ, ભારતની વિકસતી સૌર ઉત્પાદક અને સેવા પ્રદાતા, Grew (ગ્ર) એનર્જી પ્રાઇવેટ આપવામાં અને દેશનાં વિવિધ લિમિટેડએ ચીફ ઓપરેશન્સ ઓફિસર વિસ્તારોમાં પહોંચ વધારવામાં મદદરૂપ – મોડવુલ્સ બિઝનેસ તરીકે શ્રી થશે. અમે મોડવુલ્સ સેગમેન્ટમાં અમારાં હરદીપ સિંઘની નિમણુકની જાહેરાત લક્ષ્યાંકો પાર પાડવામાં અને ગ્રાહકને કરી હતી. ૩૭ વર્ષથી વધારે શ્રેષ્ઠ અનુભવ આપવા તેમનું ઉપયોગી સમયગાળામાં ફેલાયેલી સઘન માર્ગદર્શન અને સાથસહકાર મેળવવા કારકિર્દી સાથે શ્રી સિંઘ વિદેશમાં આતર છીએ." (૨૧)

વેચાણ અને Grewનાં મોડ્યુલ વ્યવસાયની કામગીરી પર નજર રાખશે. ઉત્પાદન, વેચાણ અને માર્કેટિંગ, વિતરણ, આયોજન અને કામગીરી જેવા ક્ષેત્રોમાં તેમનો બહોળો અનુભવ મોડ્યુલ્સ વ્યવસાયની વૃદ્ધિ અને વિસ્તરણ તરફ દોરી જશે. આ નિમણૂક પર Grew એનર્જીનાં સીઇઓ અને ડાયરેક્ટર શ્રી વિનય થડાણીએ કહ્યું હતું કે, "અમને Grew પરિવારમાં શ્રી હરદીપ સિંઘને આવકારવાની અતિ ખુશી છે. તેમનાં નેતૃત્વની કુશળતાઓ અને વ્યવસાયિક કુનેહ અમારા મોડ્યુલ વ્યવસાયને વેગ

#### યુવા માસ્ટરસ્ટ્રૉકઃ અખિલ ભારતીય સ્તરે રચનાત્મકતા અને કૌશલ્યની ઉજવણી



અમદાવાદ, યુવા માસ્ટરસ્ટ્રૉક ચિત્રાકળા માટે ચોક્કસ થીમ સ્પર્ધાની સફળ સમાપ્તિની જાહેરાત આપવામાં આવી હતી. "ભારતનાં કરતા, નવનીત ઍજયુક્શનની બ્રાન્ડ અને કરાજ્યોમાં વિદ્યાર્થીઓની યુવા સ્ટેશનરી ગર્વ અનુભવે છે. આ રચનાત્મકતા અને પ્રતિભાની ઉજવણી સ્પર્ધાનું આયોજન ભારતનાં વિવિધ કરતી યુવા માસ્ટરસ્ટ્રૉકની વધુ એક રાજ્યોમાં કરાયું હતું. 'યુવા સફળ આવૃત્તિના સાક્ષી બની અમે માસ્ટરસ્ટ્રૉક' એક એવો વિશિષ્ટ મંચ અત્યંત આનંદિત છીએ," એમ યુવાના છે, જે વિદ્યાર્થીઓને ચિત્રકળાના ચિફ્ર સ્ટ્રૅટેજી ઑફિસર અભિજિત માધ્યમથી તેમની અંદરની સાન્યાલે જણાવ્યું હતું. ''આ સ્પર્ધા યુવા રચનાત્મકતાને બહાર લાવવા કલાકારોને તેમની પ્રતિભા પ્રદર્શિત સશક્ત બનાવે છે. બે દાયકાથી વધુની કરવા માટેનું મંચ તો પૂરૂં પાડવાની વિરાસત સાથે, આ વર્ષ આ દંતકથા સાથે કલાત્મક અભિવ્યક્તિની સમાન સ્પર્ધાની ૨૦મી વર્ષગાંઠનું હતું. સ્પર્ધાની ૨૦૨૩ની આવૃત્તિમાં કુલ બાવીસ રાજ્યોની અધધધ કહી શકાય એટલી પરપ૧ શાળાઓ ઉત્સાહભેર સહભાગી થઈ હતી, જેમાં આશરે ૧૩.૬ લાખ વિદ્યાર્થીઓએ વિચારો અને લાગણીઓને મૂકપણે રજૂ તેમની કળાત્મક અભિરુચિ તથા કરવાની અનોખી તક આપે છે અને કલ્પનાશક્તિનું પ્રદર્શન કર્યું હતું. સહભાગીઓને ત્રણ વર્ગમાં પ્રતિભાઓને પોષે છે. યુવા માસ્ટરસ્ટ્રોક

સંસ્કૃતિનું પોષણ પણ કરે છે. વિજેતાઓને હું અભિનંદન આપું છું." યુવાનું માનુવું છે કે, ચિત્રકળા અભિવ્યક્તિની વૈશ્વિક ભાષા છે અને તેના દ્વારા વિદ્યાર્થીઓને પોતાના તેમનામાં રહેલી કુદરતી કળાત્મક વિભાજીત કરાયા હતા, દરેક વર્ગને આનો જીવંત પુરાવા સમાન છે. –

Printed and Published by MAYUR C. BHATT on behalf of KALYANI PUBLIATION PVT. LTD. and Printed at : Dharti Printers C-3, Shankar Chember, Nr. Fadia Chamber, Asharam Road, Ahmedabad-Published From KALYANI PUBLIATION PVT. LTD. 201,202,208 Nandan complex, opp mithakhali rly crossing, mithakhali, ahmedabad. Editior: Mayur C.

ઓડિશાના મંત્રાલયની સાયબર વિંગે ૪ઝ એ એપ' સાથે સંકળાયેલા કેટલાક જેમાં જાણવા મળ્યું છે કે આ પ્રકારની આ તમામ લોકો મળીને ભારતીયોને રાઉરકેલામાં આંતરરાષ્ટ્રીય સાયબર તમામ પાસાઓની ઊંડાણપૂર્વક લોકોની ધરપકડ કરી હતી. જે બાદ છેતરપિંડી કરનારા ગુનેગારોની નોકરી આપવાના નામે ઓનલાઈન કંબોડિયાથી ભારત પરત આવ્યા છે તેઓ સાયબર ક્રાઈમમાં સંડોવાયેલા મોટા પાયે સાયબર ફ્રોડની ગેંગ ઓપરેટ કરવા લાગ્યા છે. સૂત્રોએ સ્લેવરી' કરવાનો પ્રયાસ કરી રહ્યા

ખબર પડી કે જે લોકો તાજેતરમાં લાંબી યાદી છે. આ તરફ હવે આ ભરતી કરે છે. પછી કંબોડિયામાં લોકો સામે પગલાં લેવા માટે ચર્ચા કરવામાં આવી છે. ત્યાંના સાયબર સાયબર છેતરપિંડી કરવા દબાણ છે. આવા લોકો ભારતમાં આવીને ગુનેગારો કંબોડિયામાં રહેતા આ કરવામાં આવે છે. તાજેતરમાં લોકોને બળજબરીથી 'સાયબર જણાવ્યું છે કે ભારતમાંથી કંબોડિયા 🛮 છે, જેના વિશે તમામ એજન્સીઓએ ગયેલા ૪ થી ૫ હજાર લોકો છે. ત્યાં ચિંતા વ્યક્ત કરી છે અને આ અંગે જઈને તેમને બળજબરીથી સાયબર તાત્કાલિક પગલાં લેવા માટે કહેવામાં ફ્રોડમાં ધકેલી દેવામાં આવે છે. સૂત્રોએ 🛮 આવ્યું છે. સૂત્રો કહી રહ્યા છે કે, એ પણ માહિતી આપી કે આ સાયબર છેતરપિંડી કરનારાઓ સંદર્ભમાં સ્ૐછની સાયબર વિંગે કંબોડિયામાં મોટી ગેંગ ચલાવે છે. આ વિદેશ મંત્રાલયના અધિકારીઓ સાથે ગેંગમાં મલેશિયા, ચીન, વિયેતનામ એક ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજી છે. અને મ્યાનમારના લોકો સામેલ છે.

#### સ્ટર્લિંગ હોસ્પિટલે મોટી હેમેન્જિયોમા સાથે ૩ વર્ષની બાળકીનું જીવન બચાવવા લિવરની સર્જરી કરી

એક નોંધપાત્ર સીમાચિક્ષ સર કરીને સ્ટર્લિંગ હોસ્પિટલનાં ડૉક્ટર્સે ૩ વર્ષની શરૂઆતમાં બાળક મહિનાઓ સુધી પેટ ફલાઈ જવાની સમસ્યાથી પીડિત હોવાનું માનવામાં આવતું હતું. જેનું પાછળથી મોટી ઇન્ફ્રેન્ટાઇલ હેમેનજિયોમા સાથે નિદાન થયું હતું, જે દુર્લભ વેસ્ક્ર્યલર ગાંઠ છે. આ ગાંઠે બાળકીનાં લિવરનાં ૩/૪ ભાગને અસર કરી હતી. સ્ટર્લિંગ હોસ્પિટલ્સનાં ડિરેક્ટર સર્જિકલ ઑક્રોલોજી ડૉ. નીતિન સિંગલે તેમની ટીમ સાથે આ જટિલ સર્જરીનું નેતૃત્વ કર્યું હતું. બાળકનાં માતાપિતાએ પેટ અસાધારણ રીતે

અમદાવાદ, સર્જિકલ કૌશલ્યમાં થયું હતું. જયારે સામાન્ય રીતે હેમેનજિયોમાસ નાની અને મેનેજ કરી શકાય એવી હોય છે, પણ આ બાળકીમાંથી મોટી લિવર ગાંઠ કિસ્સામાં, કદ અને સ્થાન મહત્વપૂર્ણ સફળતાપૂર્વક દૂર કરી હરતી. પડકાર છે. સર્જરી સાથે સંકળાયેલી જટિલતાઓ પર ડૉ. નીતિન સિંધલે કહ્યું હતું કે, "સામાન્ય રીતે લિવર (યકૃત) સર્જરી અતિ જટિલ છે, જેમાં મોટા પાયે જીવનું જોખમ સમાન રક્તસ્ત્રાવ અને સર્જરી પછી લિવરની અપર્યાપ્તતા સંકળાયેલી છે. સામાન્ય રીતે ૧થી ૨ સેમી હેમનજિઓમાને બદલે અમે જોયું હતું કે, ગાંઠે બાળકનાં બાકીનાં લિવરનાં લગભગ ૩/૪ ભાગને અસર કરી હતી. ઉપરાંત ગાંઠનાં સ્થાનમાં ૩ હેપેટિક વેઇનમાંથી ૨ સંકળાયેલી હતી, જે અન્ય બાકીની હેપેટિક વેઇનને સ્પર્શ ફૂલાઈ ગયેલું જોયાનાં થોડાં મહિના કરે છે. પરંપરાગત સર્જરીમાં ગાંઠને પછી ડૉક્ટરની સલાહ લીધી હતી. દૂર કરવાની પ્રક્રિયામાં બાળક અતિ શરૂઆતમાં માતાપિતાએ વજનમાં નાનાં લિવર (આશરે ૨૧થી ૨૩ વધારા તરીકે આ વાતને નકારી કાઢી 🛮 ટકા) ધરાવશે, જે તેનાં માટે ભાગ્યે હતી. વધારે ચકાસણી કરતાં જ પર્યાપ્ત છે. ગાંઠનું વજન લગભગ બાળકમાં મોટી ઇન્ફ્રેન્ટાઇલ ૭૫૦ ગ્રામ હતું, જે તેનાં શરીરનાં હેમેન્જિયોમા ગાંઠ હોવાનું નિદાન વજનનાં લગભગ ૮ ટકા સમાન હતું.

#### સ્તવ્ય સ્પાઇન હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટે ગુજરાતનું પ્રથમ સર્જન-દ્વારા નિયંત્રિત રોબોટિક સર્જિકલ માઈક્રોસ્કોપ રજૂ કર્યું



અમદાવાદ, ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં આવેલ અત્યાધુનિક ટેક્નોલોજી ધરાવતી એકમાત્ર સ્તવ્ય સ્પાઈન હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યટ (SSHRI). દ્વારા નવી ZEISS KINEVO ૯૦૦ રોબોટિક સર્જિકલ માઈક્રોસ્કોપની પર કરવામાં આવતી કાર્યપ્રણાલી ને સ્થાપના સાથે કરોડરજ્સની શસ્ત્રક્રિયાના ક્ષેત્રમાં નોંધપાત્ર સિધ્ધિ હાંસલ કરી છે. આ અદ્યતન રોબોટિક સર્જિકલ અને ધ્યાન ગુમાવ્યા વિના માઇક્રોસ્કોપ, કરોડરજૂની સર્જરી માટે માઇક્રોસ્કોપને ગોળાકાર રીતે

સર્જિકલ માઇક્રોસ્કોપ છે જે પરંપરાગત ઉપકરણોથી અલગ પાડતી અનેક અગ્રણી સુવિધાથી સજ્જ છે. તેની નોંધપાત્ર નવીનતાઓમાં શક્તિશાળી રોબોટિક વિઝયલાઈઝેશન સિસ્ટમ છે. જેમાં ૧૦૦થી વધુ વિશિષ્ટ વિશેષતાનો સમાવેશ થાય છે. સર્જિકલ પ્રક્રિયા દરમિયાન સર્જનને વિશિષ્ટ વાસ્તવિક સમયની માહિતી પ્રદાન કરવા માટે ખાસ ડિઝાઈન કરવામાં આવ્યં છે. ZEISS KINEVO ૯૦૦ ની અન્ય વિશેષતા તેની વિશિષ્ટ રોબોટિક કંટોલ સિસ્ટમ છે, જે પોઈન્ટલોક તરીકે ઓળખાય છે. સર્જનો દ્વારા ઉપયોગમાં લેવાતી આ અત્યાધુનિક તકનીક કરોડરજ્રુની તકલીફ ધરાવતા દર્દીઓ સર્જિકલ ક્ષેત્રમાં એક ચોક્કસ સ્થાન પર ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા આપે છે સમર્પિત, તેના દર્દીઓને ઉચ્ચ તબીબી 🛮 વિનાપ્રયત્ને સરળતાથી ખસેડી શકે છે.

સારવાર પૂરી પાડવામાં હોસ્પિટલની

ક્ષમતા વધુ વધારી દે છે. ZEISS

KINEVO ૯૦૦ એ એક અત્યાધૃનિક

#### મારા પાત્રના સાંસ્કૃતિક ઉચ્ચારણને મેળવવા માટે નિષ્ણાંતોના સહયોગથી કેટલાક વર્કશોપમાં ભાગ લીધો હતો'', યેશા રૂઘાણી



અમદાવાદ, ઝી ટીવીનો શો રબ સે હૈં દુઆમાં એક મહિલા તેના પતિની વિનંતીની એક અલગ જ પ્રકારની વાર્તા છે, જેને હવે ૨૨ વર્ષનું લીપ લીધું છે. આ શો હવે દુઆની દિકરીઓ સાવકી બહેનો ઇબાદત કેટલાક પુરુષો તેમની બેવફાઈને (હૈદર અને ગઝલની દિકરી) અને મન્નત (હૈદર અને દુઆની દિકરી)ના જીવન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જે તેઓ બંને એક જ વ્યક્તિ સુભાનના પાત્રો અનુક્રમે યેશા રૂઘાણી અને પ્રેમમાં પડે છે અને અંગત રીતે તેઓ સીરત કપૂર કરી રહી છે. હવે નસીબ 🔝 આ બાબતમાં ફસાઈ જાય છે. આગળ તેમને પણ એક એવી જ મુશ્કેલીમાં જે કંઈપણ થશે તે દર્શકો માટે એટલું જ મુકે છે, કેમકે તે બંને વ્યક્તિ એક જ રસપ્રદ રહેશે. (૨૦-૪)

પુરુષ સુભાન (ધીરજ ધૂપર)ના પ્રેમમાં પડે છે. પ્રતિભાશાળી યેશા રૂઘાણી, ટેલિવિઝન ઉદ્યોગમાં તેના નોંધનિય કામ માટે જાણિતી છે, તે આ શોની પસંદગી શા માટે કરી તેના વિશે તથા કઈ રીતે તે શોના પાત્રની સાથે જોડાઈ અને ઇબાદતના પાત્ર માટે તેને કઈ રીતે તૈયારી કરી છે.

પ્ર. શોમાં ૨૨ વર્ષના લીપ બાદ દર્શકોને નવું શું જોવા મળશે? જ. ૨૨ વર્ષના લીપ બાદ શોમાં હવે દુઆની દિકરી- સાવકી બહેનો ઇબાદત (હૈદર અને ગઝલની દિકરી) તથા મન્નત (હૈદર અને દુઆની દિકરી)ના જીવન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તેઓ બહુપત્નિત્વના કાયદાના દુરઉપયોગ કરવાના પુરુષોની વિરુદ્ધ ઉભી છે. તેઓ એવી દલીલ કરે છે કે, કાયદેસર બનાવવા માટે આ કાયદાનો ઉપયોગ કરે છે. પણ નસીબ ફરે છે અને નોકરી કરવા ગયેલા ભારતીયને રાઉરકેલા પોલીસે આવા બે લોકોની ધરપકડ કરી હતી. પછપરછ દરમિયાન ખબર પડી કે કેવી રીતે આ લોકો ભારતના નિર્દોષ યુવાનો (કોમ્પ્યુટરના નિષ્ણાતો)ને અહીંથી લઈ જાય છે અને પછી તેમને ત્યાં 'સાયબર ગુલામી'માં ધકેલી દે છે.

તપાસ એજન્સીઓ અને સ્ૐછની સાયબર વિંગને જાણવા મળ્યું છે કે, છેતરપિંડી કરનાર કંપનીઓના માલિકો હંમેશા ચીનના નાગરિકો હોય છે. તેઓ મલેશિયન અથવા કંબોડિયન લોકોને અન્ય લોકો સાથે વાતચીત કરવા અનુવાદક તરીકે નિયુક્ત કરે છે. આ રેકેટમાં બાંગ્લાદેશ, પાકિસ્તાન, નેપાળ, ભારત અને કંબોડિયાના લોકો એજન્ટ તરીકે કામ કરે છે.

# રેલવે સંરક્ષામાં ઉત્કૃષ્ટ કાર્ય માટે અમદાવાદ ડિવિઝનના બે રેલવે કર્મચારીઓ સન્માનિત

અમદાવાદ, પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી સુધીર કુમાર શર્માએ ડિવિઝનના ૦૨ રેલવે કર્મચારીઓને સુરક્ષિત ટ્રેન ઓપરેશનમાં શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કર્યા હતા. ફેબ્રુઆરી-૨૦૨૪ના મહિનામાં રેલ્વે સંરક્ષામાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ ટ્રાફિક વિભાગના કર્મચારીઓને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. આ રેલવે કર્મચારીઓને ફરજ દરમિયાન તેમની સતર્કતા અને તકેદારીના કારણે અનિચ્છનીય ઘટનાઓને

રોકવામાં તેમના યોગદાન બદલ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં

આવ્યા હતા. અધિકારી શ્રી ઉમેશ પ્રસાદે માહિતી કુમાર, ટ્રેન મેનેજર-ગાંધીધામ અને શ્રી લોકેશ કુમાર મીના, ટ્રેન મેનેજર ગાંધીધામનું પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું બોક્સમાં બોલ્ટ ગાયબ થવા અનેૈં પ્લેટ ેડેન્જર સ્થિતિમાં મળી આવવા વગેરે કર્મચારીઓ પર ગર્વ છે.

જેવી ખામીઓ ધ્યાનમાં આવતાં તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરીને અણધારી ઘટના અને સંભવિત સિનિયર ડિવિઝનલ સંરક્ષા નુકસાનથી બચાવ્યા છે. ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી સુધીર કુમાર આપતાં જણાવ્યું હતું કે શ્રી રાકેશ શર્માએ આ સતર્ક સંરક્ષા રેલ પ્રહેરીને પ્રોત્સાહિત કર્યા. અને જણાવ્યું હતું કે યાત્રીઓની સંરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને જ્યારે રેલવે કર્મચારીઓ તેમની ફરજ દરમિયાન હતું .સન્માનિત કર્મચારીઓએ રેલ સતર્કતા અને તકેદારી સાથે કામ કરે સંરક્ષામાં ખામીઓ જેમ કે એક્સેલ છે ત્યારે તે અમને સેઈફ ટેન વર્કિંગમાં મદદ મળે છે. અમને આ રેલવે

#### ઝિંદગી એપ્રિલના મહિનામાં તમારાં સ્ક્રીન્સ પર ભાવનાઓનું કેલિડોસ્કોપ લાવે છે



અમદાવાદ, ભારતીય દર્શકોને સીમાપાર વાર્તાઓની દુનિયામાં લઈ જતી અને તેની હૃદયસ્પર્શી વાર્તાઓ માટે ઓળખાતી અવ્વલ ચેનલ ઝિંદગી દર્શકોને આ એપ્રિલમાં ભાવનાઓના અવિસ્મરણીય પ્રવાસે લઈ જવા માટે સુસજ્ર છે. તમારી આંખોમાંથી પાણી લાવી દે તેવી પળોથી લઈને તમને થવા માટે સુસક્ષ્ક રહો. (૧૯-૮)

અને પ્રેમની હૃદયસ્પર્શી વાર્તાથી તમને અટકળો લગાવવા માટે પ્રેરિત કરતી રોચક વાર્તાઓ સુધી ઝિંદગીના કાર્યક્રમો ભાવનાઓનો ખજાનો છે. હાનિયા આમિર, ફરહાન સઈદ, સજલ અલી, બિલાલ અબ્બાસ ખાન, સબા કમર, સામી ખાન જેવા પ્રતિભાશાળી કલાકારો સાથે આ મહિનાના શો નિશ્ચિત જ કાયમી પ્રભાવ પાડશે. #Kuch AchaDikhaoના જોશને અંગીકાર કરતાં ઝિંદગીનું લક્ષ્ય અપેક્ષાઓની પાર જવાનું અને દરેક સાથે સુમેળ સાધે તેવું ઉત્તમ મનોરંજન પૂરું પાડવાનું છે. તો ઝિંદગી રોચક વાર્તાઓ અને અદભુત અભિનય સાથે આગળ વધી રહી છે ત્યારે ભાવનાઓની આ દુનિયામાં ગળાડૂબ

પેટ પકડાવીને હસાવતાં દ્રશ્યો સધી

#### હું અવશ્ય મતદાન કરીશ..... તેવો સંકલ્પ ગાંધીનગર જિલ્લાના ૩ લાખથી વધુ નાગરિકોએ લીઘો :

મતદાન કરીશ.... તેવો સંકલ્પ પોતાની નૈતિક ફરજને પ્રત્યેક્ષ રીતે ગાંધીનગરની વિવિધ શાળાઓના યાદ કરાવી છે. આ લોકશાહીના બાળકો દ્વારા વાલીઓ અને અવસરમાં તેઓ અવશ્ય મતદાન ગ્રામજનોને લેવડાવવામાં આવી રહ્યો છે. આંગણે લોકસભા સામાન્ય આવ્યા છે. હું અવશ્ય મતદાન ચુંટણીનો મહા અવસર આવ્યો છે. ત્યારે શાળાના બાળકો દ્વારા ગાંધીનગર જિલ્લાના પાંચ વિધાનસભા મત વિભાગના ૩ લાખથી વઘ લોકોએ અવશ્ય મતદાન કરવાનો સંકલ્પ લીધો છે. સહભાગી થવાથી કોઇ ચૂકે નહિ, લોકશાહીના અવસર રૂપ ચૂંટણી હવે, આવી રહી છે, આ લોકશાહીના અવસરમાં મતદાન કરીને સૌ કોઇ સહભાગી બનશે. તેવો સંકલ્પ લેવડાવવાનું અભિયાન ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ સ્વીપ અંતર્ગત શરૂ કરવામાં આવ્યું છે. લોકશાહીનાં અવસરનું મૂલ્ય લોકોને સમજાય અને આ અવસરમાં સહભાગી થવાથી કોઇ ચૂકે નહિ, તેવું આયોજન સ્વીપના નોડલ અધિકારી શ્રી અને જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ર્ડા. બી.એન. પટેલ અને પ્રાથમિક શિક્ષણધિકારી શ્રી ર્ડા. પિયુષ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. ગાંધીનગર જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક શાળા અને કોલેજોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ દ્વારા લોકશાહીના મહામૂલા અવસરમાં સૌ કોઇ સહભાગી બનશે, તેવી ખાતરી સાથે સંકલ્પ લેવડાવવાનું મહા અભિયાન ગાંધીનગર જિલ્લામાં શરૂ કરવામાં આવ્યું છે. આ સંકલ્પ લેવડાવવાના અભિયાનમાં ૩,૧૫, ૧૧૨ જેટલા મતદારો પાસે સંકલ્પ પત્રો ભરાવવામાં આવ્યા છે. લોકશાહીના અવસર રૂપી લોકસભાની ચૂંટણીમાં હું અવશ્ય મતદાન કરીશ... તેવો સંકલ્પ આ મતદારોએ લીધો છે. જેમાં દહેગામમાં ૫૦,૯૭૭, ગાંધીનગરમાં ૧,૬૦,૬૭૨, કલોલમાં ૭૦,૮૬૯ અને માણસામાં ૩૨,૫૯૪ વિદ્યાર્થીઓ દ્વારા તેમના વાલીઓ અને નજીકના

પાડોશીઓને સંકલ્પ પત્રો ભરાવીને

ગાંધીનગર, હું અવશ્ય લોકશાહી દેશમાં મતદાન કરવાની કરશે, તેવા સંકલ્પ પણ લેવડાવવામાં કરીશ…. તેવા સંકલ્પ અભિયાન થકી હજુ અનેક નાગરિકોને સંકલ્પ લેવડાવવાનું આયોજન કરાયું છે. લોકશાહીનાં અવસરનં મલ્ય લોકોને સમજાય અને આ અવસરમાં તેવું આયોજન સ્વીપના નોડલ અધિકારી શ્રી અને જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ર્ડા. બી.એન. પટેલ અને પ્રાથમિક શિક્ષણધિકારી શ્રી ર્ડા. પિયુષ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. ગાંધીનગર જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક શાળા અને કોલેજોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ દ્વારા લોકશાહીના મહામૂલા અવસરમાં સૌ કોઇ સહભાગી બનશે, તેવી ખાતરી સાથે સંકલ્પ લેવડાવવાનું મહા અભિયાન ગાંધીનગર જિલ્લામાં શરૂ કરવામાં

#### લંડનના સાયન્સ મ્યુઝિયમમાં અદાણી ગ્રુપની ગ્રીન એનર્જી ગેલેરી શરૂ

લંડન, અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ શુક્રવારે લંડનના સાયન્સ મ્યુઝિયમમાં 'ધ અદાણી ગ્રીન એનર્જી ગેલેરી' ખોલવાની જાહેરાત કરી હતી. આ એનર્જી ગેલેરી "સસ્ટેનેબલ ફ્યુચરને લઇને સાયન્ટીફીક વિઝન" દર્શાવશે. ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ પોસ્ટ કરી કે "આ ગેલેરી ઓછી કાર્બન અને નવીનીકરણીય તકનીકો દ્વારા સસ્ટેનેબલ ફ્યુચરને લઇને સાયન્ટીફ્રીક વિઝનરજૂ કરશે." સાયન્સ મ્યુઝિયમની સ્થાપના ૧૮૫૭માં કરવામાં આવી હતી અને તે લંડનના મુખ્ય પ્રવાસી આકર્ષણોમાંનું એક છે. અદાણી ગ્રુપ, ભારતના ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશનમાં મોખરે, તેની પાંચ કંપનીઓ – અદાર્શો ગ્રીન એનર્જી, અદાશી એનર્જી સોલ્યુશન્સ, અદાશી પોર્ટ્સ એન્ડ SEZ, ACC અને અંબુજા સિમેન્ટ્સ માટે પણ તેની નેટવર્થમાં વધારો કરી રહી છે ''અદાણી ગ્રુપ ભારતનું સૌથી મોટું સંકલિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર છે.''

#### **MAITRI ENTERPRISES LIMITED**

CIN: L45208GJ1991PLC016853 Regd. Office: "Gayatri House", Ashok Vihar, Near Maitri Avenue Society, Opp. Govt. Eng. College, Motera, Sabarmati, Ahmedabad-380005 PHONE: 079-27506840, EMAIL: compliance@maitrienterprises.com

**NOTICE OF POSTAL BALLOT** Members are hereby informed that dispatch of the Postal Ballot Notice dated Apri 01, 2024 (along with the Explanatory Statement) to the members of the Company in respect of the Resolutions as set out in the Notice of Postal Ballot has beer completed on Tuesday, April 02, 2024 for the following resolution:

Item No. 1: To Consider and Approve the Appointment of M/s. Dinesh R. Thakkar & Co., Chartered Accountants, Ahmedabad (FRN: 102612W) as the Statutory Auditors of the Company to fill the Casual Vacancy caused by Resignation of M/s Shailesh Gandhi & Associates, Chartered Accountants, Ahmedabad (FRN

Item No. 2: To Consider and Approve the borrowing limits under section 180(1)(c) of the Companies Act, 2013.

Item No. 3: To Consider and Approve Inter-Corporate Loans, Investments, Guar antee or Security and Acquisition under Section 186 of the Companies Act, 2013 Item No. 4: To Consider and seek approval under Section 180(1)(a) of the Companies Act, 2013 inter alia for Creation of Mortgage or Charge on the Assets, Properties or Undertakings of the Company.

Pursuant to the provisions of Section 108 and other applicable provisions, if any, of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Admir istration) Rules, 2014, as amended from time to time, and Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 and Circulars issued by MCA & SEBI, the Company is offering the facility of e-voting to its Members The facility of casting votes by Member using remote e-voting system as well as e-voting during the Postal Ballot will be provided by Central Depository Services (India) Limited (CDSL) and the business may be transacted through such voting. The E-voting period commences on Saturday, April 06, 2024 at 09.00 a.m. and

ends on Sunday, May 05, 2024 at 5.00 p.m. IST. During this period, Members may cast their vote electronically. The e-voting module shall be disabled by CDSI thereafter. A vote once cast on the resolution, would not be allowed to be changed

The voting rights of Members shall be in proportion to the Equity Shares held by them in the paid-up Equity Share Capital of the Company as on Friday, March 29, 2024 (Cut-Off date). Members are eligible to cast their vote only if they are holding shares as on the cut-off date. A person who is not a Member as on the cut-off date should treat this Notice for information purpose only.

As per the SEBI circular dated December 09, 2020 read with SEBI Master Circular dated July 11, 2023 on e-voting facility provided by Listed Companies, e-voting process has been enabled to all the individual demat account holders, by way of single login credential, through their demat accounts / websites of Depositories, Depository Participants (DPs) in order to increase the efficiency of the voting process. Members are advised to update their mobile number and email address with their respective DPs in order to access e-voting facility. Detailed instruction for login methods of remote e-voting are provided in the Notice of Postal Ballot. For details relating to remote e-voting, please refer to the Notice of the Postal Ballot In case of any queries relating to voting by electronic means, please refer to the FAQ and e-voting manual available at www.evotingindia.com or contact at 022 230585542/43, in case of any grievance relating to e-voting please contact Mr. Rakesh Dalvi, Manager, Central Depository Services (India) Limited, A Wing, 25th Floor, Marathon Futurex, Mafatlal Mill Compounds, N M Joshi Marg, Lower Pare (East), Mumbai - 400013 or send an email to helpdesk evotinq@cdslindia.com o

For, Maitri Enterprises Limited

Place: Ahmedabad Date: April 02, 2024 Jaikishan Rameshlal Ambwani Managing Director DIN:(03592680)

#### સાંકેતિક કબ્જા

શાખાનું સરનામું : આઈસીઆઈસીઆઈ બેંક લિ., ઓફીસ નં. ૨૦૧-બી. બીજો માળ. રોડ નં.૧. પ્લોટ OICICI Bank નં.બીડ, વાઈફાઈ આઈટી પાર્ક, વાગલે ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ, થાણે, મહારાષ્ટ્ર -૪૦૦૬૦૪.

આથી સિક્યુરીટાઇઝેશન રિકેસ્ટ્રુક્શન ફાઇનાન્સ એસેટ એન્ડ એનફોર્સમેન્ટ ઓફ સિક્યુરિટી ઓફ ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ના કાયદા ૧૩(૧૨) હેઠળ અને સિક્યોરિટી એક્ટ (એનફોર્સમેન્ટ)રૂલ્સ, ૨૦૦૨ના રૂલ ૩ સાથે વાંચતા આઈસીઆઈસીઆઈ બેંક લિમિટેડ દ્વારા નીચે જણાવેલા દેવાદરોને માંગણા નોટિસ આપવામાં આવી હતી.(દિવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ દ્વારા આઈસીઆઈસીઆઈ બેને સોપેલ પુલ અંતર્ગત)એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરિટીના અમલીકરણના સંબંધમાં, મંજૂર કરેલ હાઉસિંગ લોનની સુવિધાના સંદર્ભમાં દેવાદારો અને ડીએચએફએલની વચ્ચે થયેલા લોન કરાર અનુસાર દેવાદારો ને નોટિસમાં જણાવેલી રકેમ નોટિસ મલ્યાના ૬૦ દિવસની અંદર પરત કરવા અંગે જાણ કરવામાં આવે છે.

દેવાદારો બાકી લેણાં રકમ પરત કરવામાં નિષ્ફળ ગયા છે. આથી જાહેર જનતા અને દેવાદારોને સૂચિત કરવામાં આવે છે કે સેક્શન ૧૩(૪) અને ઉપરોક્ત રૂલ્સના રૂલ ૮ હેઠળ મલતાં અધિકારોની રૂએ નીચે જણાવેલી મિલકતોનો નીચે જણાવેલી તારીખે સાંકેતિક કબ્જો લઈ લેવામાં આવેલ છે. આઈસીઆઈસીઆઈ બેંક લિમિટેડ પાસે મિલકતો ટાંચમાં હોઈ જાહેર જનતાને અને દેવાદારોને નીચે જણાવેલી મિલકતો સાથે કોઈ પણ જાતનો સોદો ન કરવા માટે તાકિદ કરવામાં આવે છે.

ı		ના માટે માટે કરવામાં આવે છે.						
	ક્રમ નં.	1	મિલકતોની વિગતો / લાગુ પડતી મિલકતો	િકમાન્ડ નોટીસની તારીખ/ડિમાન્ડ નોટીસમાંની ૨કમ(રૂા)	શાખાનું નામ			
	`	(જુના ડીએચએફએલ લેન નંબર	ફ્લેટ નં.૧૦૨, પહેલો માળ, ટાવર-ઈ, ફાતિમા હાઇટસ, આતિફ નગર પાસે, ટંડાલજા રોડ, આર.એસ.નં.૨પ૩-૨પ૪, સી.ટી.એસ.નં.૧૬૨ -૧૬૩, ટી.પી.એસ.નં.૨૬, એફ.પી.નં. ૧૬, ટંડાલજા, વડોદરા-૩૯૧૧૦૦/ માર્ચ ૨૮, ૨૦૨૪	રૂા. ૧૩,૬૨,૭૫૨.૦૦/-	વડોદરા			

ઉપર જણાવેલા કરજદાર(રો)/જામીનદાર(રો)અહીં બાકી નાણાં પરત કરી જવા માટે ૩૦ દિવસની નોટીસ આપવામાં આવેલ છે, જો નાણાં નોટિસ જાહેર થયાના ૩૦ દિવસની અંદર બાકી લેણાં રેકર્મ પરત કરવામાં નહીં આવે તો સિક્યોરિટી એક્ટ (એનફોર્સમેન્ટ)રૂલ્સ, ૨૦૦૨ના રૂલ ૮ અને ૯ની જોગવાઈઓ મુજબ ઉપર જણાવેલી મિલકતોનું વેચાણ કરવામાં આવશે.

તારીખ : એપ્રિલ ૦૩, ૨૦૨૪

સ્થળ : વડોદરા

અધિકૃત અધિકારી આઈસીઆઈસીઆઈ બેંક લિમિટેડ